



સંસ્કૃતિ-૧૫

40 Roohani Ilaj Ma Tibbi Ilaj (Gujarati)



يَا اللَّهُ يَا اللَّهُ يَا اللَّهُ
يَا مَلِكُ يَا مَلِكُ يَا مَلِكُ
يَا سَلَامُ يَا سَلَامُ يَا سَلَامُ
يَا عَزِيزُ يَا عَزِيزُ
يَا قَهَّارُ يَا قَهَّارُ يَا قَهَّارُ
يَا حَكِيمُ يَا حَكِيمُ يَا حَكِيمُ



40 રૂહાની ઇલાજ મઝ તિબ્બી ઇલાજ

શૈખે તરીકત, અમીરે અહલે સુન્નત, બાનિયે દા'વતે ઇસ્લામી, હજરતે અલ્લામા મૌલાના અબુ ઝિલાલ

મુહમ્મદ ઈબ્ન્યા અતાર કાદિરી ર-ઝવી دَامَتْ بَرَكَاتُهُمْ
الْعَالِيَهُ

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَرَحْمَتِهِ إِنَّ اللَّهَ لَشَدِيدُ الْعِقَابِ

किताब पढने की दुआ

दीनी किताब या इस्लामी सबक पढने से पहले जैल में दी हुई दुआ पढ लीजिये **إِنَّ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** जो कुछ पढ़ेंगे याद रहेगा. दुआ येह है:

**اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِمَمَتَكَ وَأَنْشُرْ
عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ**

तरजमा : ओ अल्लाह! हम पर इल्मो हिकमत के दरवाजे खोल दे और हम पर अपनी रहमत नाजिल करमा ! ओ अ-उमत और बुजुर्गों वाले!

(مُسْتَطْرَف ج ۱ ص ۴۰ دارالفکر بیروت)

गमे मदीना, भकीअ,
मुक़िरत और बे हिसाब
जन्तुल किरदोस में आका
के पओस का ताविब



13 शवाबुल मुकर्रम 1428 हि.

(अव्वल आभिर ओक बार दुइइ शरीफ़ पढ लीजिये.)

40 इहानी इलाज मअ तिब्बी इलाज

येह रिसाला (40 इहानी इलाज मअ तिब्बी इलाज)

शैभे तरीकत, अमीरे अहले सुन्नत, बानिये दा'वते इस्लामी हजरत अल्लामा मौलाना अबू बिलाल मुहम्मद इल्यास अतार कादिरि र-उवी जियाई **دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَةِ** ने उर्दू ज़बान में तहरीर करमाया है.

मजलिसे तराजिम (दा'वते इस्लामी) ने इस रिसाले को गुजराती रस्मुल खत में तरतीब दे कर पेश किया है और मक-त-बतुल मदीना से शाअेअ करवाया है. इस में अगर किसी जगह कमी बेशी पाअें तो मजलिसे तराजिम को (ब जरीअअे मक्तूब, ई-मेईल या SMS) मुत्तलअ करमा कर सवाब कमाईये.

राबिता : **मजलिसे तराजिम** (दा'वते इस्लामी)

मक-त-बतुल मदीना, सिलेकटेड हाउस, अलिफ़ की मस्जिद के सामने, तीन दरवाजा, अहमदआबाद-1, गुजरात, इन्डिया

MO. 9374031409 E-mail : translationmaktabhind@dawateislami.net

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ
 أَمَا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

40 इहानी घलाज

मअ तिब्बी घलाज

दुइद शरीफ़ की इमीलत

अद्लाउ एज़ोज़ल के प्यारे उबीअ, उबीअे लबीअ,
 तबीअों के तबीअ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ का इरमाने रहमत
 निशान है : जो मुअ पर शअे जुमुआ और रोअे जुमुआ (या'नी
 जुमा'रात के गुइअे आइताअ से ले कर जुमुआ का सूइअ डूअने तक)
 सो बार दुइद शरीफ़ पढे अद्लाउ तआला उस की सो हाअतें
 पूरी इरमाअेगा 70 आअिरत की और 30 दुन्या की.

(شُعَبُ الْإِيمَانِ ج ٣ ص ١١١ حديث ٣٠٣٥)

صَلُّوا عَلَى الْحَبِيبِ! صَلَّى اللهُ تَعَالَى عَلَى مُحَمَّدٍ

હર વિદ કે અવ્વલ વ આખિર એક બાર દુરુદ શરીફ પઠ લીજિયે, ફાએદા ઝાહિર ન હોને કી સૂરત મેં શિક્વા કરને કે બજાએ અપની કોતાહિયોં કી શામત તસવ્વુર કીજિયે, અલ્લાહ عَزَّوَجَلَّ કી હિક્મત પર નઝર રખિયે.

﴿1﴾ “هُوَ اللَّهُ الرَّحِيمُ” જો હર નમાઝ કે બા’દ સાત બાર પઠ લિયા કરેગા اِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ શૈતાન કે શર સે બચા રહેગા ઓર ઉસ કા ઈમાન પર ખાતિમા હોગા.

﴿2﴾ “يَا اللَّهُ” 100 બાર સોતે વક્ત પઠને સે اِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ શયાતીન કી શરારત વ ફાલિજ ઓર લકવે કી આફત સે હિફાઝત હોગી.

﴿3﴾ “يَا مَلِكُ” 90 બાર જો ગરીબ વ નાદાર રોઝાના પઠા કરે اِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ ગુરબત સે નજાત પાએગા.

❖4❖ “**يَا قُدُّوسُ**” કા જો કોઈ દૌરાને સફર વિદ કરતા રહે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** થકન સે મહફૂઝ રહેગા.

❖5❖ “**يَا سَلَامُ**” 111 બાર પઢ કર બીમાર પર દમ કરને સે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** શિક્ષા હાસિલ હોગી.

❖6❖ “**يَا مُهَيِّنُ**” 29 બાર જો કોઈ ગમઝદા રોઝાના પઢ લે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** ઉસ કા ગમ દૂર હો નીઝ **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** આફતોં ઓર બલાઓં સે ભી મહફૂઝ રહે.

❖7❖ “**يَا عَزِيزُ**” 41 બાર હાકિમ યા અફસર વગૈરા કે પાસ જાને સે કબલ પઢ લીજિયે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** વોહ હાકિમ યા અફસર મેહરબાન હો જાએગા.

❖8❖ “**يَا مُتَكَبِّرُ**” 21 બાર રોઝાના પઢ લીજિયે, ડરાવને ખ્વાબ આતે હોંગે તો **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** નહીં આએંગે. (મુદતે ઇલાજ : તા હુસૂલે શિક્ષા)

﴿9﴾ “يَا مُتَكَبِّرٌ” ઝોજા સે “મિલાપ” સે કબ્લ 10

બાર પઠ લેને વાલા **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** નેક બેટે કા બાપ બનેગા.

﴿10﴾ “يَا بَارِئُ” 10 બાર જો કોઈ હર જુમુઆ કો પઠ

લિયા કરે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** ઉસ કો બેટા અતા હોગા.

﴿11﴾ “يَا قَهَّارُ” 100 બાર અગર કોઈ મુસીબત આ

પડે તો પઢિયે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** મુશ્કિલ આસાન હોગી.

﴿12﴾ “يَا وَهَّابُ” સાત બાર જો રોઝાના પઠા કરેગા

إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ મુસ્તજાબુદા'વાત હોગા (યા'ની ઉસ કી દુઆએ કબૂલ હુવા કરેંગી)

﴿13﴾ “يَا فَتَّاحُ” 70 બાર જો રોઝાના બા'દ નમાઝે

ફજા દોનોં હાથ સીને પર રખ કર પઠા કરેગા **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ**

ઉસ કે દિલ કા ઝંગ વ મૈલ દૂર હોગા.

❖14❖ “**يَافْتَاخُ**” સાત બાર જો રોઝાના (કિસી ભી વક્ત દિન મેં એક મર્તબા) પઢા કરેગા **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** ઉસ કા દિલ રોશન હોગા.

❖15❖ “**يَا قَابِضُ، يَا بَاسِطُ**” 30 બાર જો હર રોઝ પઢા કરે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** વોહ દુશ્મન પર ફત્હ પાએગા.

❖16❖ “**يَا رَافِعُ**” 20 બાર જો રોઝાના પઢા કરેગા **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** ઉસ કી મુરાદ પૂરી હોગી.

❖17❖ “**يَا بَصِيرُ**” સાત બાર જો કોઈ રોઝાના બ વક્તે અસ્ર (યા'ની ઈબ્તિદાએ વક્તે અસ્ર તા ગુરુબે આફતાબ કિસી ભી વક્ત) પઢ લિયા કરેગા **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** અચાનક મૌત સે

મહફૂઝ રહેગા.

❖18❖ “يَاسِيَعُ” 100 બાર જો રોઝાના પઢે ઓર ઈસ દોરાન ગુફત-ગૂ ન કરે ઓર પઢ કર દુઆ માંગે
 إِنَّ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ જો માંગેગા પાએગા.

❖19❖ “يَا حَكِيمُ” 80 બાર જો રોઝાના પાંચોં નમાઝોં કે બા'દ પઢ લિયા કરે, إِنَّ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ કિસી કા મોહતાજ ન હો.

❖20❖ “يَا جَلِيلُ” દસ બાર પઢ કર જો અપને માલો અસ્બાબ ઓર રકમ વગૈરા પર દમ કર દે إِنَّ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ યોરી સે મહફૂઝ રહેગા.

❖21❖ “يَا شَهِيدُ” 21, બાર સુબહ (તુલૂએ આફતાબ સે પહલે પહલે) ના ફરમાન બચ્ચે યા બચ્ચી કી પેશાની

પર હાથ રખ કર આસ્માન કી તરફ મુંહ કર કે જો પઢે
 اِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ (ઉસ કા વોહ બચ્ચા યા બચ્ચી નેક બને.

﴿22﴾ “يَا وَكَيْلُ” સાત બાર જો રોઝાના અસ્ર કે વક્ત
 પઢ લિયા કરે اِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ આફતોં સે પનાહ પાએ.

﴿23﴾ “يَا حَيِّدُ” 90 બાર, જિસ કી ગન્દી બાતોં કી
 આદત ન જાતી હો વોહ પઢ કર કિસી ખાલી પિયાલે યા
 ગિલાસ મેં દમ કર દે. હસ્બે ઝરૂરત ઉસી મેં પાની પિયા કરે
 اِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ ફોહ્શ ગોઈ (યા'ની બે હયાઈ કી બાતોં) કી
 આદત નિકલ જાએગી. (એક બાર કા દમ કિયા હુવા ગિલાસ
 બરસોં તક ચલા સકતે હૈં)

﴿24﴾ “يَا مُحْصِي” એક હઝાર બાર, જો કોઈ હર શબે

જુમુઆ (યા'ની જુમા'રાત વ જુમુઆ કી દરમિયાની શબ) પઢ લિયા કરે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** કબ્ર વ કિયામત કે અઝાબ સે મહફૂઝ હો.

﴿25﴾ **“يَا مُحْيِي”** 7 બાર પઢ કર અપને ઉપર દમ કર લીજિયે, ગેસ હો યા પેટ યા કિસી ભી જગહ દર્દ હો યા કિસી ઉઝ્વ કે ઝાએઅ હો જાને કા ખૌફ હો **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** ફાએદા હોગા. (મુદતે ઇલાજ : તા હુસૂલે શિફા, રોઝાના કમ અઝ કમ એક બાર)

﴿26﴾ **“يَا مُحْيِي، يَا مُمِيتُ”** સાત બાર રોઝાના પઢ કર અપને ઉપર દમ કર લિયા કીજિયે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** જાદૂ અસર નહીં કરેગા.

﴿27﴾ **“يَا وَاجِدُ”** જો કોઈ ખાના ખાતે વક્ત હર નિવાલે પર પઢા કરેગા **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** વોહ ખાના ઉસ કે પેટ મેં નૂર હોગા ઓર બીમારી દૂર હોગી.

﴿28﴾ “**يَا مَاجِدُ**” 10 બાર પઢ કર શરબત વગૈરા પર દમ કર કે જો પી લિયા કરે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** (સખ્ત) બીમાર ન હોગા.

﴿29﴾ “**يَا وَاحِدُ**” એક હઝાર એક બાર, જિસ કો અકેલે મેં ડર લગતા હો, તન્હાઈ મેં પઢ લે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** ઉસ કે દિલ સે ખોફ જાતા રહેગા.

﴿30﴾ “**يَا قَادِرُ**” જો વુઝૂ કે દૌરાન હર ઉઝ્વ ધોતે હુએ પઢને કા મા'મૂલ બના લે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** દુશ્મન ઉસ કો ઇગ્વા નહીં કર સકેગા.

﴿31﴾ “**يَا قَادِرُ**” 41 બાર, મુશ્કિલ આ પડે તો પઢ લીજિયે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** આસાની હો જાએગી.

﴿32﴾ “**يَا مُقْتَدِرُ**” 20 બાર, જો રોઝાના પઢ લિયા

કરેગા. **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** રહમતોં કે સાએ મેં રહેગા.

❖33❖ “**يَا مُقْتَدِرُ**” 20 બાર, જો નીંદ સે બેદાર હો કર પઢ લિયા કરેગા. ઉસ કે હર કામ મેં મદદે ઈલાહી શામિલ રહેગી.

❖34❖ “**يَا أَوَّلُ**” 100 બાર, જો રોઝાના પઢ લિયા કરેગા. **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** ઉસ કી ઝોજા ઉસ સે મહબ્બત કરેગી.

❖35❖ “**يَا مَانِعُ، يَا مُعْطِي**” 20 બાર, બીવી નારાઝ હો તો શોહર ઓર અગર શોહર નારાઝ હો તો બીવી સોને સે કબલ બિછોને પર બેઠ કર પઢે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** સુલ્હ હો જાએગી. (મુદત : તા હુસૂલે મુરાદ)

❖36❖ “**يَا ظَاهِرُ**” ઘર કી દીવાર પર લિખ લીજિયે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** દીવાર સલામત રહેગી.

﴿37﴾ “يَا رَعُوفُ” જો કિસી મઝલૂમ કા કિસી ઝાલિમ સે પીછા છુડાના ચાહે, 10 બાર પઢે ફિર ઉસ ઝાલિમ સે બાત કરે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** વોહ ઝાલિમ ઉસ કી સિફારિશ કબૂલ કર લેગા.

﴿38﴾ “يَا غَنِيُّ” રીઠ કી હડી, ઘુટનોં, જોડોં યા જિસ્મ મેં કહીં ભી દર્દ હો, ચલતે ફિરતે ઉઠતે બેઠતે પઢતે રહિયે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** દર્દ જાતા રહેગા.

﴿39﴾ “يَا مُغْنِيُّ” એક બાર પઢ કર હાથોં પર દમ કર કે દર્દ કી જગહ પર મલને સે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** સુકૂન મિલેગા.

﴿40﴾ “يَا نَافِعُ” 20 બાર, જો કોઈ કામ શુરૂઅ કરને સે કબ્લ પઢ લે **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** વોહ કામ ઉસ કી મરઝી કે મુતાબિક પૂરા હોગા.

15 તિબ્બી ઇલાજ

❁ 1, 2 ❁ બાલ લમ્બે કરને કે દો નુસ્ખે

❁ 250 ગ્રામ આમ્લા, 125 ગ્રામ સિકાકાઈ
 ઓર 125 ગ્રામ મેથી દાને પીસ કર મહફૂઝ કર લીજિયે.
 દો ચમ્મચ હસ્બે ઝરૂરત પાની મેં રાત કો ભિગો દીજિયે,
 સુબહ છાન કર સર ધો લીજિયે, હફ્તે મેં એક બાર યેહ
 અમલ કીજિયે, **اِنْ شَاءَ اللهُ عَزَّوَجَلَّ** બાલ ગિરના બન્દ હોંગે ઓર
 બાલ લમ્બે હોને ભી શુરૂઅ હો જાએંગે ❁ આમ્લે કા
 સુફૂફ (પાઉડર) બનવા લીજિયે, હસ્બે ઝરૂરત પાઉડર મેં
 પાની મિલા કર ગાઢા સા લેપ બના લીજિયે, ફિર ઉસે
 તમામ બાલોં કી જડોં મેં લગા કર કુછ દેર બા'દ સર ધો
 લીજિયે.

❁ 3 ❁ दांतों के दर्द और सूजन का तिब्बी घलाज

मसूढों में सूजन हो, जून या पीप निकलता हो तो थोडा सा गर्म पानी ले कर उस में थोडी सी झिट्करी डाल दीजिये, झिट्करी हल हो जाने के बाद वोह पानी दांतों और मसूढों पर मलिये, *إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ* काई इअेदा होगी।

❁ 4, 5 ❁ शूगर का तिब्बी घलाज

❁ बडी इलायची के अन्दर से दाने निकाल कर रोजाना सुबह व शाम पांच पांच दाने चबा लिया करें, *إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ* जल्द शिफा हासिल होगी ❁ आम्ला, जामुन के बीज और करेलों के बीज येह तीनों चीजें हम वज़न ले कर उन का सुकूड़ (पाउडर) बना दीजिये, जियाबीतुस (DIABETES) की उम्दा दवा तय्यार है, इस सुकूड़ की अेक छोटी चम्मच

દિન મેં એક યા દો બાર લેના મરઝ બઢને સે રોકતા હૈ.

❁ 6 ❁ માહવારી કે દર્દ કા તિબ્બી ઘલાજ

જિસ કો માહવારી (M.C.) કે દિનોં મેં પેટ ઓર કમર વગૈરા મેં દર્દ હોતા હો, નાફ મેં તેલ લગા લિયા કરે,
 اِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ દર્દ સે છુટકારા મિલ જાએગા.

❁ 7, 8 ❁ દસ્ત (લૂઝ મોશન) કે 2 તિબ્બી ઘલાજ

❁ આધી ચમ્મચ ચાય કી પત્તી પાની સે ફાંક લીજિયે
 اِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ દસ્ત ખત્મ હો જાએંગે. છોટે બચ્ચોં કો એક ચુટકી ચાય કી પત્તી પાની સે દેના હી કાફી હૈ,
 اِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ ઉન કો ભી ફાએદા હો જાએગા ❁ સબ્ઝ પોદીના ધૂપ મેં સુખા કર, પીસ કર ઉસ કા પાઉડર કિસી બોતલ મેં મહફૂઝ કર લીજિયે. અગર કભી દસ્ત (લૂઝ મોશન) લગ જાએ તો

સુબહો શામ આધા ચમ્મચ પાની સે ઇસ્તિ'માલ કીજિયે
 اِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ મે'દે મેં ઠન્ડક હો જાએગી ઓર શિક્કા હાસિલ
 હોગી.

❁9❁ નકસીર બન્દ કરને કા તિબ્બી ઇલાજ

લીમૂં કા રસ કપડે મેં છાન કર ડ્રોપર સે નાક મેં
 કતરા કતરા ડાલિયે, اِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ ખૂન બન્દ હો જાએગા.

❁10❁ નાક બન્દ હોને કા તિબ્બી ઇલાજ

રાત કો નાક બન્દ હો જાએ ઓર સાંસ લેને મેં
 રુકાવટ આતી હો તો નીમ કે થોડે સે તાઝે પત્તે સાફ કર કે
 ઈન કો પાની મેં ચુલ્હે પર જોશ દે કર ખાને કા નમક હલ
 કર કે કાબિલે બરદાશત હો જાને પર ઉસ પાની સે નાક
 ધોઈયે ઓર દિન મેં દો બાર ઈસી સે ગરારે કીજિયે,
 اِنْ شَاءَ اللّٰهُ عَزَّوَجَلَّ નાક ખુલ જાએગી.

❁ 11, 12 ❁ हियकी के दो युटकुले

❁ कागज की थेली या प्लास्टिक का शोपर मुंह और नाक पर बढा कर हाथों से इस तरह दबा कर रबिये के नाक और मुंह की सांस की हवा बाहर न निकलने पाये, उसी शोपर के अन्दर सांस लीजिये, **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** अेक दो मिनट के अन्दर अन्दर हियकी बन्द हो जायेगी

❁ अेक छोटी धलाययी अख्ठी तरह बढा कर निगल लीजिये और झौरन ठन्डे पानी का अेक गिलास पी लीजिये, **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** हियकी बन्द हो जायेगी.

❁ 13 ता 15 ❁ मुंह की बढबू के तीन तिब्बी घलाज

❁ कखी पियाज और कख्या लहसुन खाने से मुंह में बढबू हो जाती है, अदरक का टुकडा खूब बढा कर खा लीजिये, इसी तरह अजवाईन या, गुड या सौंड़ या

यन्द् छोटी धारायियां भूब यभा कर निगल लीजिये,
 ان شاء الله عزوجل बढभू भत्त हो जायेगी ❖ नीम के 12 पत्ते
 ओक गिलास पानी में अखी तरह उबाल कर छान
 लीजिये, पानी की गरमी कुछ कम होने पर धस से गरारे
 कीजिये, येह जरासीम कुश है, धस के भा काँधदा
 धस्ति'माल से मुँह का अन्दरुनी हिस्सा साँह होता और
 मुँह की बढभू दूर हो जाती है. ❖ नीम गर्म पानी में
 नमक मिला कर गरारे कीजिये, नमक में पाये जाने वाले
 अनासिर मुर्दा भलियों को निकाल कर मुँह की बढभू दूर
 करते हैं.

येह रिसाला पढ कर दूसरे को हे दीजिये

शादी गमी की तकरीबात, धजतिमाआत, आ'रास और जुलूसे भीलाह
 वगैरा में मक-त-भतुल मदीना के शाअेअ कर्दा रसाँल और म-दनी इलो पर मुश्तमिल
 पेम्फ्लेट तक्सीम करके सवाब कमाँये, गाहकों को ब नियते सवाब तोहके में देने के
 लिये अपनी दुकानों पर भी रसाँल रबने का मा'भूल बनाँये, अज्बार
 इरोशों या बय्यों के जरीअे अपने मडले के घर घर में माहाना कम अज कम
 ओक अदद सुन्तों बरा रिसाला या म-दनी इलो का पेम्फ्लेट पडोंया कर नेकी
 की दा'वत की धूमें मयाँये और भूब सवाब कमाँये.

गमे मदीना, बकीअ,
 मग्दिरत और बे हिसाब
 जन्तुल किरदौस में आका
 के पओस का तालिब




17 र-जबुल मुरज्जब 1435 सि.हि.

05-05-2014

સુન્નત કી બહારે

تَبَلِّغِے کُرآنُو سُننات کِ آلاَمَگِیرِ گَیرِ سِیَاسِیِ تَلْهِرِکِ دَا'وَتَے عِسْلاَمِیِ کَے مَلْکَے مَلْکَے م-دَنِیِ مَالِکِلِ مَیںِ بَ کَسرَتِ سُنناتِے سِیْہیِ اُورِ سِیْہَا'ئِ جَاتِیِ ھِے، ھَرِ جُومَا'را'tِ عِشا کِیِ نَمَازِ کَے اِبا'ءِ اِپ کَے شَھَرِ مَیںِ ھونَے والَے دَا'وَتَے عِسْلاَمِیِ کَے ھَکِیتاَوارِ سُنناتِوں اِبرَے عِجْتی_ما_ا مَیںِ رِیْجا_اے عِلا_یِ کَے لِی_ے ا_ج_ڑِیِ ا_ج_ڑِیِ نِی_ھ_ی_تِوں کَے سا_یِ سا_ریِ را'tِ گُجا_رنَے کِیِ م-دَنِیِ عِی_تی_ج_ا ھِے. اِشِکا_نَے ر_سُولِ کَے م-دَنِیِ کاکِیلِوں مَیںِ بَ نِی_ھ_ی_تَے سَوا_بِ سُنناتِوں کِیِ تار_بِی_ھ_تِ کَے لِی_ے س_ھَرِ اُورِ ر_وْجا_نا کِیکَے مَدِی_نا کَے ج_ڑِی_اے م-دَنِیِ عِنْ_ا_ما_ا'tِ کِا رِسا_لا پُورِ کَر کَے ھَرِ م-دَنِیِ مِا_ھ کَے عِی_تی_دا'ئِ ھَس دِی_ن کَے ا_ندَر ا_ندَر ا_پ_نَے ی_ہا_ں کَے کِی_م_ہ_دا_ر کَو ج_م_ھ کَر_وا_نَے کِا مِا'مُولِ ب_نا لِی_جِی_ے، اِن کَے ا_ک_ت سے پ_ا_ب_ند_ہ سُنناتِ ب_ن_ن_ے، گُنا_ہوں سے ن_ک_ر_ت کَر_نَے اُورِ عِی_مانِ کِیِ ھِکِا_ج_ت کَے لِی_ے کُھ_نَے کِا جَہ_دِ ب_ن_ے_گا.

ھَرِ عِسْلاَمِیِ اِبا'ئِ ا_پ_نا ی_ھ جَہ_دِ B_نا_اے کَے “مُجَے ا_پ_نیِ اُورِ سا_ریِ دُنْیا کَے لو_گِوں کِیِ عِسْلا_ھ کِیِ کَوشِش کَر_نیِ ھِے. اِن کَے ا_ک_ت کِیِ کَوشِش کَے لِی_ے “م-دَنِیِ عِنْ_ا_ما_ا't” پَر ا_م_لِ اُورِ سا_ریِ دُنْیا کَے لو_گِوں کِیِ عِسْلا_ھ کِیِ کَوشِش کَے لِی_ے “م-دَنِیِ کاکِیلِوں” مَیںِ س_ھَر کَر_نا ھِے. اِن کَے ا_ک_ت.



મક-ત-અતુલ મદીના

દા'વતે ઈસ્લામી

ફેઝાને મદીના, શ્રી કોન્યા બગીચે કે સામને, મિરઝાપૂર, અહમદઆબાદ-1. ગુજરાત, ઇન્ડિયા

Mo.091 93271 68200 E-mail : maktabaahmedabad@gmail.com www.dawateislami.net